

Student Assistance for Coaching Class For NEET/JEE/GUJCET

➤ યોજનાનો હેતુ

- ધો. ૧૦માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના તાલીમાર્થી તથા આર્થિક રીતે પછાતવર્ગની વિદ્યાર્થીનીઓને NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે. યોજના શરૂ થયાનું વર્ષ : વર્ષ ૨૦૧૪-૧૫

➤ તાલીમાર્થીઓના નીચે મુજબના ધારાધોરણના આધારે કોચિંગ સહાય મળવા પાત્ર રહેશે.

- મૂળ ગુજરાતના વતની હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થી(વિદ્યાર્થી અને વિદ્યાર્થીની બંને) તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીનીને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
- તાલીમાર્થીએ ધોરણ-૧૦માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય.
- તાલીમાર્થી વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી હોવો જોઈએ.
- તાલીમાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૬.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
- તાલીમાર્થીએ સંસ્થા પાસેથી તાલીમની હાજરીનું પ્રમાણપત્ર મેળવી રજૂ કરવાનું રહેશે.
- તાલીમાર્થીને આ યોજનાનો લાભ ધોરણ-૧૨માં એક જ વાર મળવાપાત્ર થશે.
- તાલીમાર્થી તાલીમ દરમિયાન અન્ય સ્થળે નોકરી કરી શકશે નહિ. જો તેમ સાબિત થશે તો, પુરી રકમ નિયામક, વિકસતી જાતિ કલ્યાણ દ્વારા વસુલ કરવાની રહેશે.
- સંસ્થાના ત્રણ વર્ષના અનુભવ અંગેનું ચાર્ટડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર સંસ્થા પાસેથી મેળવીને રજૂ કરવાનું રહેશે.

➤ તાલીમાર્થીએ નીચે મુજબના ધારાધોરણ ધરાવતી સંસ્થા કોચિંગ સહાય માટે પસંદ કરવાની રહેશે.

- તાલીમાર્થીએ પસંદ કરેલ સંસ્થા GST/PAN નંબર ધરાવતી હોવી જોઈએ.
- તાલીમ આપતી સંસ્થા મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦, કંપની અધિનિયમ, ૧૯૫૬, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૮ (ફુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮) વગેરે જેવા કોઈપણ અધિનિયમ હેઠળ નોંધણી થયેલ હોવી જોઈએ.
- સંસ્થા ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતી હોવી જોઈએ.
- સંસ્થા અન્ય સરકારી ધારાધોરણોનું પાલન કરતી હોવી જોઈએ.

➤ રજુ કરવાના ડોક્યુમેન્ટ

- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- એસ.એસ.સી. ની માર્કશીટ
- ધોરણ- ૧૨ માં જે તે શાળામાં અભ્યાસ કરતાં હોય તે અંગેનું પ્રમાણ પત્ર (બોનાફાઇડ)
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર

તાલીમ સંસ્થાએ આપવાનું થતું પ્રમાણપત્ર

સંસ્થાનું નામ:-

સરનામું-

GST NO:

CONTECT NO:

આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે અમારી સંસ્થા..... નામે સરનામે ચાલતા NEET, JEE, GUJCET ની પરીક્ષાની પુર્વ તૈયારી કરવા માટેના તાલીમ વર્ગો ચાલે છે. અમારી સંસ્થા..... વર્ષનો અનુભવ ધરાવે છે. અત્રેના તાલીમ સ્થળ પર સી.સી.ટી.વી. કેમેરા, ફાયરસેફ્ટી અંગેનું એન.ઓ.સી. તેમજ વિદ્યાર્થીની હાજરી માટે બાયોમેટ્રીક મશીન પણ ઉપલબ્ધ છે તેમજ હાલમાં ઉપરોક્ત સરનામે કાર્યરત અવસ્થામાં છે. સરકારશ્રી દ્વારા જ્યારે પણ કોઈ માહિતી માંગવામાં આવશે તો તે અંગેની વિગત અમો મોકલી આપીશું. શ્રી રહે..... તા..... જી.....ને તા.....થી તા.....સમયગાળા માટે.....તાલીમ વર્ગમાં પ્રવેશ આપેલ છે.

તા.

સ્થળ

તાલીમ સંસ્થાના ચાર્ટડ એકાઉન્ટન્ટના સહી/સિક્કા

તાલીમ સંસ્થાના વડાના સહી/સિક્કા

શાળાએ આપવાનું થતું પ્રમાણપત્ર

આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે, શ્રી
રહે..... તા..... જી..... અત્રેની શાળા
માં (નામ અને સરનામું) ધોરણ-૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં..... વર્ષમાં પ્રવેશ મેળવેલ છે. તેનો જનરલ
રજીસ્ટર નંબર છે. જેની ખાત્રી બદલ આ પ્રમાણપત્ર આપવામાં આવે છે.

તા.

આચાર્યશ્રીના સહી/સિક્કા

સ્થળ:-